

તમે અને તમારું સ્ટોમા

સ્ટોમા શું છે?

સ્ટોમા ગીક શબ્દ છે જેનો અર્થ થાય છે ‘ખુલતુ’ અથવા ‘મોઢુ’. સામાન્યરીતે સ્ટોમા ત્રણ પ્રકારના હોય છે:

- ડોલોસ્ટોમી: મોટી બાઉલમાંથી
- ઇલેઓસ્ટોમી: નાની બાઉલમાંથી
- યુરોસ્ટોમી: યુરોસ્ટોમી મુત્રાશયનું ડાયવર્જન છે

મને સ્ટોમા શા માટે થયું છે?

તમારે વિવિધ કારણોસર ઓપરેશન કરાવવું પડશે અને તમારા સર્જન તથા સ્પેશ્યાલીસ્ટ નર્સ આ બધું તમને સમજાવશે. ઘણા બધા રોગો અને પરિસ્થિતિઓ હોય છે જેને સ્ટોમાની જરૂરમાં પરિણામે છે જેવા કે:

- | | |
|---|--|
| <ul style="list-style-type: none"> ➢ અલ્સરેટીવ કોલાઈટીસ ➢ કોહનનો રોગ ➢ ડાયવર્ટીક્યુલર રોગ ➢ ફાએકલ ઇનકન્ટીનન્સ ➢ કેન્સર | <ul style="list-style-type: none"> ➢ ટ્રોમા ➢ ફેમીલીઅલ એડેનોમાટોસ પોલીપોસીસ ➢ રેડીયેશન નુકશાન ➢ કન્જેનીઅલની અસામાન્યતા ➢ મુત્રાશય કામ કરતું બંધ થઈ જવું |
|---|--|

તમારી સજરી પહેલાં

તમને તમારી સજરી પહેલાં તમારા સર્જનને તથા સ્પેશ્યાલીસ્ટ નર્સને એક કે બે વખત મળવાની તક હશે. જ્યાં તમને તમારી સજરીના બધા પાસાઓ વિશે જણાવવામાં આવશે, લેખિત માહિતી આપવામાં આવશે અને સૌથી વધુ શક્યતા કે વિચારણા કરવા પ્રોડક્ટ્સ બતાવવામાં આવશે. તમારી ઓપરેશન માટેની મુલાકાત પહેલાં, તમને તમારી સારવારના કોઈપણ પાસાના સવાલો પૂછવાનો અને ચર્ચા કરવાનો સમય હોવો જોઈએ. તમારી એપોઇન્ટમેન્ટ પહેલાં, તમે આ બાબતોની ચર્ચા કરવા માટે, જે તમે તમારી સાથે લઈ જઈ શકો, જેથી તમે કઈક પૂછવાનું ભૂલી ન જાઓ, તેવી એક સુચિ બનાવવાની શરૂઆત કરવાનું ઈચ્છશો.

આ એક સારો વિચાર છે કે પ્રિ-ઓપરેટીવ એપોઇન્ટમેન્ટમાં તમારા કુટુંબના એક સભ્યને અથવા સંભાળ રાખનારને તમારી સાથે લઈ જાઓ, કારણકે ઘણી બધી માહિતી લેવાની હોય છે.

સ્ટોમાની સંભાળ લેતી નર્સીંગ ટીમ તમારી મુસાફરી દરમયાન એક ચાવી બની રહેશે અને તે તમને તથા તમારા કુટુંબ/સંભાળ રાખનારાઓને સલાહ તથા સહાય આપવા માટે ઉપલબ્ધ હશે.

સ્ટોમા કેવું દેખાશે અને મને કેવું લાગશે ?

તે અડકવામાં સુંવાળું હશે, રંગમાં ગુલાબી – લાલ તથા લીનું; તમારા મોઢાના અંદરના ભાગ જેવું કદાચ. સ્ટોમામાં સંવેદનાશીલતા હોતી નથી તેથી તે પીડાદાયક નથી. તેમાં જો કે ભરપૂર લોહીનો પૂરવણો હોય છે, તેથી સમયાંતરે થોડું લોહી નીકળવું સામાન્ય છે, ખાસ કરીને જ્યારે તેને સાફ કરતા હોઈએ ત્યારે. પ્રથમ તો તમારું સ્ટોમા સોજુ જઈ શકે તે શક્યતા છે અને સાઈઝ ઘટવામાં થોડો સમય લાગશે. તમારા સ્ટોમાની ઘારની આસપાસ નાના ટાંકા હશે જે પીગળી જોશે અથવા તમારી સ્ટોમા કેર નર્સ ઓપરેશન પછી તેને 1-2 અઠવાડિયામાં દૂર કરશે.

તમારી સજરી પછી

તમે જ્યારે તમારા ઓપરેશન પછી જાગશો, તમે થાકેલા હો તેવું લાગશો. એ શક્ય છે કે તમે આ સમય દરમયાન તથા તે પછી થોડો સમય શ્રેણીબદ્ધ ઉદ્વેગ અનુભવશો. આ અલગ પડશે કારણકે અમે બધા જુદા જ હીએ.

તમારા શરીરમાં ફ્રીપ અને ડેઇન નળીઓ જોડેલી હશે પરંતુ આક્સિમિકતાથી ભય પામવાની જરૂર નથી – આ એક સામાન્ય બાબત છે. આ બધી ઠીક થઈ જોશે ત્યારે કાઢી નાંખવામાં આવશે અને થોડીક અસુવિધા સાથે.

દરેક સ્ટોમા જુદા જુદા હોય છે અને તેને કામ શરૂ કરવામાં થોડો સમય લાગે છે. તમારા સ્ટોમા કેર નર્સ સાથે આની ચર્ચા કરવી સૌથી ઉત્તમ રહેશે.

તમારી ત્વચાની સંભાળ

તમારી ત્વચાની સંભાળ લેવી તે સ્ટોમાની સાર સંભાળ લેવાનો એક આવશ્યક ભાગ છે.

તમારી સજરી પછી તુરત જ તમારો સ્ટોમા અને આજબાજની ત્વચા સોજી ગઈ હોય તેવી લાગશે અને થોડીક બળતરા પણ થશે. આ બધું ઓપરેશન પછી અપેક્ષિત છે અને સમય જતાં સારી સાર સંભાળથી તેનાં દેખાવમાં સુધારો થશે.

તમને જણાશો કે તમારી પ્રોડક્ટની જરૂરિયાતમાં તમારા સ્ટોમાના કદ અને આકારમાં ફેરફારને કારણે પરિવર્તન આવશે. તમારાં સ્ટોમા ટેપટેટમાં પરિવર્તન થશે અને પ્રથમ ૪ અઠવાડિયા દરમ્યાન ઓછામાં ઓછું અઠવાડિયે એક વખત ચેક કરવું જોઈએ અથવા ખાસ કરીને કાણામાં તંદુરસ્ત ત્વચા દેખાય ત્યારે.

તમારા સ્ટોમાની આસપાસની ત્વચાના વિસ્તારમાં પીડાના જોખમને અટકાવવા અને સાર-સંભાળ ચાલુ રાખવાની અને ધ્યાન રાખવાની જરૂર રહે છે. જો તમને પીડા થવાનું શરૂ થાય, બળતરા કે ચામડી ફાટે તો તમારા સ્ટોમા કેર નર્સનો સારવાર અને અવેજુ પ્રોડક્ટની જરૂરિયાત માટે યોગ્ય સલાહ લેવા સંપર્ક સાધવામાં મોડન કરતા.

સ્ટોમા સાથે જીવનું

જ્યારે તમે હોસ્પિટલમાંથી પ્રથમ છૂટા થશો ત્યારે તમે થાકેલા જણાશો અને રોજીંદા કાર્યોમાં જાણો કે વાયુનો ફૂવારો છૂટતો હોય તેવું લાગશે. આ સામાન્ય છે અને સમય જતાં સુધરશે. શરૂઆતમાં તમે જ્યારે તમારી સજરીમાંથી સાજા થતા હશો ત્યારે થોડી પીડા અને અસુવિધા અનુભવશો. આ રીકવરીનો એક સામાન્ય ભાગ છે. આ સમય દરમ્યાન ટાઇટ ફિટીંગના કપડા નિવારો કારણકે તમારું પેટ પીડા કરતું હશે અને સોજી ગાયું હશે.

મોટી સજરી પછી ઉદ્વેગ થવો તે સામાન્ય છે તેથી જો તમારે ઉદાસ કે અશ્વપુર્ણ દિવસો હોય તો ચિંતા ન કરતા. પરિવાર અને મિત્રો સાથે વાત કરશો તો મદદ બનશો – એવું ન માનો કે તમારે એકલાએ જ મુકાબલો કરવાનો છે. તમારું સ્ટોમાની કેર નર્સ તમને સહાય કરવા ત્યાં જ છે અને પેશન્ટ સપોર્ટ ગૃપ પણ છે જે તમને મદદ પણ કરી શકે.

સહાય માટે પૂછવામાં ગભરાઓ નહિં.

તમારા સ્ટોમા બેગ બદલવી પ્રથમ ધીમી હશે, પરંતુ પ્રેક્ટીસથી અને જેમ તમે આત્મવિશ્વાસ મેળવશો તેમ આ તમારા સામાન્ય રોજીંદા જીવનનો ભાગ બની જશે.

તમારો પુરવઠો મેળવવો.

તમને હોસ્પિટલમાંથી બેગનો પુરવઠો અને કોઈક વધારાના સાધનો જેની તમને જરૂર પડે તે સાથે છૂટા કરવામાં આવશે. તમારી સ્ટોમા કેર નર્સે તમારા રાજ્યમાં કોઈ ઓસ્ટોમી એસોસીએશન સાથે સહી કરાવી આપ્યા હશે જ્યાંથી તમે તમારો માસિક પૂરવઠો મેળવી શકો છો. ત્યાં સભ્ય ફી હશે, જો કે તમારે તમારા એસોસીએશન સાથે ચર્ચા કરવાની જરૂર છે, તેવું છે.



① સોલ્ટ્સ હેલ્થકેર લિમિટેડ. ② સોલ્ટ્સ હેલ્થકેર લિમિટેડ 2019. સોલ્ટ્સ હેલ્થકેર લિમિટેડના પ્રોડક્ટસ અને ડ્રેમાર્ક યુ.કે. અને વિદેશી પેટન્ટ, રજિસ્ટર્ડ ટ્રાગ્રાહિન્સ અને ટ્રેડમાર્કથી સુરક્ષિત છે. વધુ વિગત માટે કૃપા કરી www.salts.co.uk ની મુલાકાત લો.